

SHARANAM INFRAPROJECT AND TRADING LIMITED

Regd. Office: 303, Earth Arise, Nr. Y.M.C.A. Club, S. G. Road, Makarba, Vejalpur, Ahmedabad, 380051, Gujarat,

CIN: L45201GJ1992PLC093662, Contact No. 079-29707666,

Email id: sharanaminfraproject@gmail.com, Website: www.sharanaminfra.co.in

=====

Date: 18th September, 2023

To,
BSE Limited
Phiroze Jeejeebhoy Tower,
Dalal Street,
Mumbai-400 001

Dear Sir / Madam,

Sub: Submission of Newspaper Advertisement for Notice of AGM, Book Closure & E-voting

Ref: Security Id: SIPTL / Code: 539584

We hereby enclose herewith copies of the public notice of the 31st Annual General Meeting of the Company and Information on Book Closure and E-voting, published on 18th September, 2023 in the following newspapers:

1. English Newspaper – Financial Express Newspaper and
2. Regional Language Newspaper (Gujarati) – Financial Express Newspaper

Kindly take the same on your record and oblige us.

Thanking You,

Yours Faithfully

For, Sharanam Infracore and Trading Limited

Jigneshkumar Ambalia
Managing Director
DIN: 07784782

SBI STATE BANK OF INDIA

Regional Business office-5, Opp Madhvani College, National Highway, Porbandar-360577

POSSESSION NOTICE FOR IMMOVABLE PROPERTY UNDER RULE 8(1)

Whereas, The undersigned being the Authorised Officer of the State Bank of India under Securitisation and reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred under sec on 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice dated 05/07/2023 calling upon the Borrowers Mr. Yakub Alarkha Shekh to repay the amount mentioned in the notice being Rs. 13,60,352/- (Rupees: Thirteen Lac Sixty Thousand Three Hundred Fifty Two only) as on 05/07/2023 and interest thereon within 60 days from the date of receipt of the said notice with further interest and incidental expenses.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrowers and the public in general that the undersigned has taken symbolic possession of the property described herein below in exercise of powers conferred on him/her under Sec on 13(4) of the said Act read with Rule 8 of the said rules on this 11th day of Sept 2023.

The Borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the State Bank of India for the amount of Rs. 13,60,352/- (Rupees: Thirteen Lac Sixty Thousand Three Hundred Fifty Two only) as on 05/07/2023 and interest thereon & applicable charges.

Name of the Borrowers and Guarantors	Description of immovable property	Amt (O/s) (As per Notice U/s 13(2))	Date of demand
Mr. Yakub AlarkhaShekh	Residential property situated at Revenue survey no. 29/1 Paiki 2, Plot No. 15 Paiki part A, Khodiyar Park A, Ranavav, Dist- Porbandar Admeasuring 51.925SqMtr.	Rs. 13,60,352/- (Rupees: Thirteen Lac Sixty Thousand Three Hundred Fifty Two only)	Demand Notice- 05/07/2023 Date of Possession 11/09/2023

Place:- PORBANDAR Date 16.09.2023 Authorised Officer State Bank of India

Recovery & Write-off Department, Region - II

Correspondence Address : Horizon Building, 1st Floor, Ranade Road & Gokhale Road Junction, Gokhale Road (North), Dadar (West), Mumbai - 400 028. Phone No. 022- 24476012/28/57/58

POSSESSION NOTICE [See Rule-8(1)]-for Immovable Properties

Whereas, the undersigned being the Authorised Officer of The Cosmos Co-op. Bank Ltd., appointed under the provisions of Securitisation & Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 (Act 54 of 2002) and in exercise of the powers conferred u/s 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice to the following parties thereby calling upon the Borrower Company Through its Directors, Guarantors & Mortgagors AND Borrower Firm through its sole proprietor & Guarantors to repay the amount as mentioned in the notices within 60 days from the date of receipt of the said notices.

The Borrower Company Through its Directors, Guarantors & Mortgagors AND Borrower Firm through its sole proprietor & Guarantors having failed to repay the amount, notice is hereby given to the Borrower Company Through its Directors, Guarantors & Mortgagors AND Borrower Firm through its sole proprietor & Guarantors and the public in general that the undersigned has taken CONSTRUCTIVE POSSESSION of the properties described herein below being its Secured Assets, in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on 14th day of September 2023. The Borrower Company Through its Directors, Guarantors & Mortgagors AND Borrower Firm through its sole proprietor & Guarantors attention is invited to provisions of sub section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The Borrower Company Through its Directors, Guarantors & Mortgagors AND Borrower Firm through its sole proprietor & Guarantors in particular and the public in general is hereby cautioned not to deal with the properties described herein below and any dealings with the properties will be subject to the charge of The Cosmos Co-op. Bank Ltd. being a Secured Creditor thereof for an amount mentioned hereunder with interest, cost and incidental charges thereon.

Sr. No.	Name of the Borrower Company, Directors, Mortgagors & Guarantors and Name of Branch - Zaveri Bazar	Date of Demand Notice & Amount
1.	Borrower/Mortgagor Company :- M/s. Falcon Gold House Pvt. Ltd. Director/Guarantor:- Mr. Vipul Guvantirai Vithalani Director/Guarantor/Mortgagor:- Mr. Vishal Mahendra Vicchi	Demand Notice Date : 13.02.2023 of ₹ 3,09,19,929.00 Plus Further Interest & Charges there on from 01.02.2023 The said Demand Notice is published in Newspapers i.e. "Free Press Journal (English) and Navshakti (Marathi)" at Mumbai Addition and "Financial Express (English) and Financial Express (Gujarathi) at Ahmedabad Edition on 13.03.2023 as a "Substitute Service".

Description of Properties of Sr. No. 1 (Immovable Properties)

1) All that immovable property bearing Flat/Unit No.3/F/401 (as per plan sanctioned by AUDA Flat No.3/C/401) admeasuring about 204.46 Sq. Mtrs. equivalent to 2200 Sq. Ft. (Super Built up area situated on Fourth Floor above hollow plinth (Third floor as per plan sanctioned by AUDA of Block No. "F" (Block No. "C" as per approved plan) of "Shree Balaji Wind Park" scheme, together with undivided share admeasuring about 47.32 Sq. Mtrs. equivalent to 509.21 Sq. Fts. in the land of the scheme bearing Final plot No.82/2 of Town Planning Scheme no 63 (Khoraj) Allotted in lieu of old revenue Survey Nos.510 Paiki, 526 Paiki, 529 Paiki and 532 Paiki situated, lying and being at Mouje : Khoraj, Taluka Gandhinagar, within the Registration Sub-District : Gandhinagar and District : Gandhinagar and the same is bounded as under :

- On or towards East : By Flat No.3/F/402
- On or towards North : By Common Space
- On or towards West : By Common Space
- On or towards South : By Flat No.3/F/404

2) All that immovable property bearing Flat/Unit No.3/F/402 (as per plan sanctioned by AUDA Flat No.3/C/402) admeasuring about 204.46 Sq. Mtrs. equivalent to 2200 Sq. Fts. (Super Built up area situated on Fourth Floor above hollow plinth (Third floor as per plan sanctioned by AUDA of Block No. "F" (Block No. "C" as per approved plan) of "Shree Balaji Wind Park" scheme, together with undivided share admeasuring about 47.32 Sq. Mtrs. equivalent to 509.21 Sq. Fts. in the land of the scheme bearing Final plot No.82/2 of Town Planning Scheme no 63 (Khoraj) Allotted in lieu of old revenue Survey Nos.510 Paiki, 526 Paiki, 529 Paiki and 532 Paiki situated, lying and being at Mouje : Khoraj, Taluka Gandhinagar, within the Registration Sub-District : Gandhinagar and District : Gandhinagar and the same is bounded as under :

- On or towards East : By Common Space
- On or towards North : By Common Space
- On or towards West : By Flat No.3/F/401
- On or towards South : By Flat No.3/F/403

3) All that immovable property bearing Flat/Unit No.3/F/903 (as per plan sanctioned by AUDA Flat No.3/C/903) admeasuring about 204.46 Sq. Mtrs. equivalent to 2200 Sq. Fts. (Super Built up area) situated on Ninth Floor above hollow plinth (Eighth floor as per Plan sanctioned by AUDA of Block No. "F" (Block No. "C" as per approved plan) of "Shree Balaji Wind Park" scheme, together with undivided share admeasuring about 47.32 Sq. Mtrs. equivalent to 509.21 Sq. Fts. in the land of the scheme bearing Final plot No.82/2 of Town Planning Scheme no 63 (Khoraj) Allotted in lieu of old revenue Survey Nos.510 Paiki, 526 Paiki, 529 Paiki and 532 Paiki situated, lying and being at Mouje : Khoraj, Taluka Gandhinagar, within the Registration Sub-District : Gandhinagar and District : Gandhinagar and the same is bounded as under :

- On or towards East : By Common Space
- On or towards North : By Flat No.3/F/902
- On or towards West : By Flat No.3/F/904
- On or towards South : By Common Space

4) All that immovable property bearing Flat/Unit No.3/F/904 (as per plan sanctioned by AUDA Flat No.3/C/904) admeasuring about 204.46 Sq. Mtrs. equivalent to 2200 Sq. Ft. (Super Built up area situated on Ninth Floor above hollow plinth (Eighth floor as per plan sanctioned by AUDA of Block No. "F" (Block No. "C" as per approved plan) of "Shree Balaji Wind Park" scheme, together with undivided share admeasuring about 47.32 Sq. Mtrs. equivalent to 509.21 Sq. Fts. in the land of the scheme bearing Final plot No.82/2 of Town Planning Scheme no 63 (Khoraj) Allotted in lieu of old revenue Survey Nos.510 Paiki, 526 Paiki, 529 Paiki and 532 Paiki situated, lying and being at Mouje : Khoraj, Taluka Gandhinagar, within the Registration Sub-District : Gandhinagar and District : Gandhinagar and the same is bounded as under :

- On or towards East : By Flat No.3/F/903
- On or towards North : By Flat No.3/F/901
- On or towards West : By Common Space
- On or towards South : By Common Space

Sr. No.	Name of the Borrower and Guarantors Name of Branch-Dadar West	Date of Demand Notice & Amount
2.	Borrower Firm/Mortgagor:- M/s. Lux Lights (Proprietorship Firm) Sole Prop. Mrs. Parul Jayesh Desai Guarantors:- 1. Mrs. Jayshree Uday Desai 2. Mrs. Bhavna Vinay Desai 3. Mr. Vishal Mahendra Vichhi 4. Mr. Uday Bhikubhai Desai	Demand Notice Date : 19.04.2023 ₹ 1,56,33,264.66 Plus Further Interest & Charges there on from 01.04.2023

Description of Properties of Sr. No. 2 (Immovable Property)
All that immovable property bearing Flat/Unit No.3/F/203 (As per Plan Sanctioned by AUDA Flat No.3/C/203) on 2nd floor (as per Plan by AUDA 1st floor) of Block No. F (Block No. C as per Plan by AUDA), admeasuring about 204.46 Sq. Mtrs. i.e. 2200 Sq Ft. (Super Built-Up area) together with undivided share 47.32 Sq. mtrs. i.e. 509.21 Sq. Fts. area in the land of scheme known as "Shree Balaji Windpark" together with 1 (One) allotted Car parking on the land bearing Non Agriculture Residential purpose Final Plot No.82/2 of T.P.Scheme No.63 (Khoraj) of Survey No. 510P 526P 529P & 532P situate, lying and being at Mouje Khoraj, Taluka Gandhinagar, District Gandhinagar within limit of Registration District Ahmedabad and Sub-District Gandhinagar and the same is bounded as under :-

- On or towards East : By Common Space
- On or towards North : By Common Space
- On or towards West : By Flat No.3/F/204
- On or towards South : By Flat No.3/F/202

Date: 14.09.2023 Authorised Officer Under SARFAESI Act, 2002 The Cosmos Co-Operative Bank Ltd.

BAJAJ HOUSING FINANCE LIMITED

Corporate Office: Conerium IT Park B2 Building 5th floor, Kalyani Nagar, Pune, Maharashtra 411014. Branch Office: 1st Floor, Pranay Complex, Above Vodafone, Milan Talkies Road, Surendranagar - 363002. AND 4th Floor, Aurum Avenue, Opp- Mayer Bungalow, Nr- Lawgardens, Elisbridge, Ahmedabad - 380006

POSSESSION NOTICE

U/s 13(4) of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002. Rule 8-(1) of the Security Interest (Enforcement) Rules 2002. (Appendix-IV)

Whereas, the undersigned being the Authorized Officer of M/s BAJAJ HOUSING FINANCE LIMITED (BHFL) under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 and in exercise of powers conferred under section 13(2) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued Demand Notice(s) to Borrower(s) / Co-Borrower(s) / Guarantor(s) mentioned herein below to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice. The Borrower(s) / Co-Borrower(s) / Guarantor(s) having failed to repay the amount, notice is hereby given to the Borrower(s) / Co-Borrower(s) / Guarantor(s) and the public in general that the undersigned on behalf of M/s Bajaj Housing Finance Limited, has taken over the possession of the property described herein below in exercise of the powers conferred on him under Section 13(4) of the said Act read with Rule 8(1) of the said rules. The Borrower(s) / Co-Borrower(s) / Guarantor(s) in particular and the public in general are hereby cautioned not to deal with the below said property and any dealings with the said property will be subject to the first charge of BHFL for the amount(s) as mentioned herein under with future interest thereon.

Name of the Borrower(s) / Guarantor(s) (LAN No, Name of Branch)	Description of Secured Asset (Immovable Property)	Demand Notice Date & Amount	Date of Possession
Branch : SURENDRANAGAR (LAN No. H538ECN0363858, H538JRL0193261) 1. NAROTTAMBHAJI DHIRUBHAI LALADIYA (Borrower) At: At Pagivas, Na Nake, Limbdi, Gujarat-363421 2. DHIRUBHAI SUKHABHAI LALADIYA (Co-Borrower) At Pagivad, Na Nake, Ugama Para, Limbdi, Gujarat-363421	All That Piece And Parcel Of The Non-agricultural Property Described As: Property of House With Land Admeasuring 34.22 Sq Mtrs Bearing Limbdi City Survey No 2423 Of Ward No 2, Situated At Area Known As Ugama Para, Pagi Vaas, Nr. Satvara Bhojan Shala, At Limbdi, Ta Limbdi Dist Surendranagar, East : Road, West : Gallery , North : C.s.no.2424, South : House Of Dalvadi Bhikha Khokha	29th June 2023 Rs. 4,37,860/- (Rupees Four Lac Thirty Seven Thousand Eight Hundred Sixty Only)	13.09.2023
Branch : AHMEDABAD (LAN No. H418HP030135) 1. SHAILESH MAKWANA (Borrower) At: A-201 Hemangi Apartment, IOC Road Ahmedabad-382424 Also At: Shop No F31, Krishna Avenue, IOC Road, Ahmedabad 2. MANJULABEN MAKWAN (Co-Borrower) At A-201 Hemangi Apartment, IOC Road Ahmedabad-382424	All That Piece And Parcel Of The Non-agricultural Property Described As: Shop No F 31 Karishma Avenue Ioc Road Bhaktinagar Chandkheda Ahmedabad Gujarat-382424, East - Society Common Plot West :- 80 Ft Road , North :- Shop No F/30, South :- Shop No F/32	24th June 2023 Rs. 29,36,584/- (Rupees Twenty Nine Lac Thirty Six Thousand Five Hundred Eighty Four Only)	13.09.2023

Date: 18 .09. 2023 Place:- GUJARAT Authorized Officer Bajaj Housing Finance Limited

SBI STATE BANK OF INDIA

Regional Business office-5, Opp Madhvani College, National Highway, Porbandar-360577

POSSESSION NOTICE FOR IMMOVABLE PROPERTY UNDER RULE 8(1)

Whereas, The undersigned being the Authorised Officer of the State Bank of India under Securitisation and reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred under sec on 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice dated 06/07/2023 calling upon the Borrowers Mr. Shailesh Ratanshi Khetarpal & Mrs. Lataben Ratanshibhai Khetarpal to repay the amount mentioned in the notice being Rs. 45,29,970/- (Rupees: Forty Five Lac Twenty Nine Thousand Nine Hundred Seventy only) as on 06/07/2023 and interest thereon with further interest and incidental expenses.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrowers and the public in general that the undersigned has taken symbolic possession of the property described herein below in exercise of powers conferred on him/her under Sec on 13(4) of the said Act read with Rule 8 of the said rules on this 11th day of Sept 2023.

The Borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the State Bank of India for the amount of Rs. 45,29,970/- (Rupees: Forty Five Lac Twenty Nine Thousand Nine Hundred Seventy only) as on 06/07/2023 and interest thereon & applicable charges.

Name of the Borrowers and Guarantors	Description of immovable property	Amt (O/s) (As per Notice U/s 13(2))	Date of demand
Mr. Shailesh Ratanshi Khetarpal & Mrs. Lataben Ratanshibhai Khetarpal	Residential property situated at city survey ward no. 3, Survey No- 3218/8 Paiki, Laxminagar, Opp- GEB Colony, Porbandar Admeasuring 56.2977 Sq Mtr.	Rs. 45,29,970/- (Rupees: Forty Five Lac Twenty Nine Thousand Nine Hundred Seventy only)	Demand Notice- 06/07/2023 Date of Possession 11/09/2023

Place:- PORBANDAR Date 16.09.2023 Authorised Officer State Bank of India

AXIS FINANCE LIMITED

(CIN U65921MH1995PLC212675)
Axis House, C-2, Wadia International Centre, Pandurang Budhkar Marg, Worli, Mumbai - 400 025

E-PUBLIC AUCTION-CUM-SALE NOTICE

E Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 read with provision to Rule 8 (6) and Rule 9 (1) of Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower/s, Guarantor/s and Mortgagor/s, that the below described immovable properties mortgaged / charged to Secured Creditor, the PHYSICAL POSSESSION of which has been taken by the Authorised Officer of Axis Finance Limited, Secured Creditor, will be sold on "AS IS WHERE IS", "AS IS WHAT IS", and "WHATEVER THERE IS" and "WITHOUT RECOURSE BASIS", on 26th October, 2023 for recovery of Rs. 52,12,380/- (Rupees Fifty-Two Lacs Twelve Thousand Three Hundred Eighty Only) as on 15th September, 2023 (amount of Rs. 42,96,000/- as per the demand notice dated 15th July, 2022 issued u/s 13(2) of SARFAESI Act - Rs. 43,97,401/- (Rupees Forty-Three Lakh Ninety-Seven Thousand Four Hundred One Only) with further interest at the contractual rates, along with default/penal interest and other charges etc., till final payment / realization from the Borrower / Mortgagors / Guarantors, i.e. 1) PATEL MAHEK NIRAJKUMAR (Borrower & Mortgagor), 2) PATEL PARUL NIRAJKUMAR (Co-Borrower & Mortgagor), (hereinafter collectively referred to as "the Borrowers"). The Description of Assets, Reserve Price (RP), Earnest Money Deposit (EMD) and Details of Sale are as below:

Name of Borrower/ Mortgagor		Description of Property/s	Date & Time of e-Auction	Auction Sale Details:		Date & Time for Bid Submission
(1) PATEL MAHEK NIRAJKUMAR (Borrower & Mortgagor)	As per SCHEDULE - I	EMD (10% of RP) (Rs.in Words)	26.10.2023	Reserve Price:	On:	24.10.2023
				(Rs. in Figures)	(Rs. in Words)	
(2) PATEL PARUL NIRAJKUMAR (Co-Borrower & Mortgagor)	with unlimited extensions of 5 minutes each	Rupees Sixteen Lacs Fifty Thousand Only	From: 11:00 am to: 12:00 noon	42,96,000/-	Rupees Forty Two Lacs Ninety Six Thousand Only.	4:00 pm
				* Price below which the Flat /property/s will not be sold		
Earnest Money Deposit (EMD):		EMD (10% of RP) (Rs.in Words)	Contact Person Details & Mob. Nos.:			
4,29,600/-		(10% of RP) (Rs.in Words)	Mr. Ankit Surana: 7718885589			
Rupees Sixteen Lacs Fifty Thousand Only			Mr. Swapnell Thwari: 9820063208			
Bid Increment Amount:			Ms. Payal Gheewala: 885037471			
Rs. 1,00,000/- (Rupees One Lakh Only).						

For detailed terms and conditions of sale, please refer to the link provided in website i.e. <https://sarfaesi.auctionreg.net/EPROC/> and www.axisfinance.in

STATUTORY 30 DAYS SALE NOTICE UNDER RULE 8 (6) / RULE 9 (1) OF SECURITY INTEREST (ENFORCEMENT) RULES 2002.

This may also be treated as notice under Rule 8(6) and Rule 9(1) of Security Interest (Enforcement) Rules, 2002 to the borrower/s, guarantor/s and mortgagor/s of the said loan about the holding of E-Auction Sale on the above mentioned date.

Date: 15th September, 2023 Place: Mumbai Authorised Officer Axis Finance Limited

Sharanam Infracore and Trading Limited

CIN: L45201GJ1992PLC093662

Registered Office: 303, Earth Arise, Nr. Y.M.C.A. Club, S. G. Road, Makarba, Vejalpur, Ahmedabad - 380 051

Phone: 079-29707666 | Email: sharanaminfracore@gmail.com Website: www.sharanaminfracore.co.in

Notice of the 31st Annual General Meeting of the Company, Book Closure and E-voting

Notice is hereby given that:

1. The 31st Annual General Meeting ("AGM") of the Members of the Company will be held on Saturday, 30th September, 2023 at 02:00 P.M. through Video Conferencing (VC) / Other Audio Video Means (OAVM) to transact the ordinary and special businesses as set out in the notice of AGM.

2. As per SEBI Circular dated 12th May, 2020, Physical Copy of the Annual Report for the 31st AGM inter-alia is not required to be sent; therefore Annual Report is being sent only through electronic mode to those Members as on 15th September, 2023, whose email addresses are registered with the Company / Depositories. Members whose e-mail id is not registered / updated can register / update their e-mail address.

3. The Notice of 31st AGM and Annual Report for Financial Year 2022-23 will also be made available on the Company's website i.e. www.sharanaminfracore.in, website of stock exchanges i.e. BSE Limited at www.bseindia.com.

4. Notice is hereby further given that pursuant to Section 91 of the Companies Act, 2013 read with rules made thereunder and as per Regulation 42 of SEBI (LODR) Regulations, 2015, the register of Members and Share Transfer Book of the Company will remain closed from Saturday, 23rd September, 2023 to Saturday, 30th September, 2023 (both days inclusive) for purpose of 31st Annual General Meeting.

5. As per Section 108 of the Companies Act, 2013 read with rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 as amended and clause 44 of SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015, the Company is pleased to provide the members the facility to cast their votes electronically from a place other than the venue of the AGM (remote E-voting) on all resolutions set forth in the Notice, for which the Company has engaged the services of National Securities Depository Limited as the E-voting agency. All the members are informed that;

A. The Ordinary and Special Businesses as set out in the notice of AGM may be transacted through voting by electronic means.

B. The remote e-voting shall commence on 27th September, 2023 at 09:00 A.M. & shall end on 29th September, 2023 at 05:00 P.M.

C. The cut-off date for determining the eligibility to vote by electronic means or at AGM is Saturday, 23rd September, 2023.

D. Any person, who acquires shares of the Company and become member of the Company after dispatch of the Notice of AGM and holding shares as of the cut-off date i.e. Saturday, 23rd September, 2023, may obtain the login ID and password by sending a request at evoting@nsdl.co.in. However, if you are already registered with NSDL for remote e-voting then you can use your existing user ID and password for casting your vote.

E. Members may note that a) the remote e-voting module shall be disabled by NSDL after the aforesaid date and time for voting and once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently; b) E-voting facility shall be available after AGM for those who have not voted; c) the members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their vote again; and d) a person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date shall only be entitled to avail the facility of remote e-voting as well as voting in the general meeting.

6. The Company has appointed Ms. Gaurav Bachani & Associates as the Scrutinizer to scrutinise the E-voting process in fair and transparent manner.

7. Any Query or grievance connected with the remote e-voting may be addressed to the Company Secretary of the Company at E-mail sharanaminfracore@gmail.com or you may refer the Frequently Asked Questions (FAQs) for Members and remote e-voting user manual for Members available at the download section of www.evoting.nsdl.com or call on toll free no. : 1800-222-990 for any further clarification.

For, Sharanam Infracore and Trading Limited

Sd/- Jigneshkumar Ambalia Managing Director DIN: 07784782

Date: 18/09/2023 Place: Ahmedabad

arrive at a conclusion not an assumption. Inform your opinion with detailed analysis.

The Indian Express. For the Indian Intelligent. JOURNALISM OF COURAGE

Home First Finance Company India Limited

CIN: L65990MH2010PLC240703, Website: homefirstindia.com Phone No.: 180030008425 Email ID: loanfirst@homefirstindia.com

NOTICE OF SALE THROUGH PRIVATE TREATY

The undersigned as Authorized Officer of Home First Finance Company India Limited (Home First) has taken over possession of the schedules property, in terms of section 13(4) of the subject act in connection with outstanding dues payable by you to us. Please refer our Notice dated mentioned below, wherein we informed that we have published Auction Notice in the newspaper mentioned by fixing the Reserve Price as mentioned. The Auction was scheduled on the date as mentioned. The Auction could not be successful due to lack of any bidder.

Public at large is informed that the secured property(ies) as mentioned in the Schedule are available for sale through Private Treaty, as per the terms agreeable to the Company for realisation of Company's dues on "AS IS WHERE IS BASIS" and "AS IS WHAT IS BASIS". Hence, in terms of the provisions of the subject Act and Rules made thereunder, we issue this notice to you to enable you to discharge the amount due to the Company within 15 days from the date of this notice and take back the assets mentioned in the schedule, failing which the assets will be sold to discharge the liabilities. This is without prejudice to any other rights available to the Company under the subject Act or any other law in force.

The interested parties may contact the Authorized Officer for further details/clarifications and for submitting their offers. Sale shall be in accordance with the provisions of SARFAESI Act/ Rules.

S. No.	Name of the Account/ Guarantors	Details of property/ owner of the property	Outstanding amount as on Demand Notice (in INR)	Date of Sale Notice	Newspaper	Date of e-Auction	Reserve Price (in INR)	No. of Authorised Officer
1.	Sonu Rakesh, Sarita Sonu	Plot-741, Green Park 3, Block no. 31, Beside Sheeji Residency, Nr. Haldharu High School, Moje Haldaru, Haldharu-Parab Road, Taluka Kamrej, Surat, Gujarat- 394310.	10,27,490	15-08-2023	Financial Express (English + Gujarati)	15-09-2023	8,59,202	8238994548
2.	Hardik Chandubhai Solanki, Solanki Ranjanben Chandubhai	Flat-101, Block-C-2, Amrut Kunj, Beside Opera Palace, Laskana - Kholvad Road, Surat Gujarat 395006	14,09,693	15-08-2023	Financial Express (English + Gujarati)	15-09-2023	15,99,028	9173734990

STATUTORY 15 DAYS SALE NOTICE UNDER THE SARFAESI ACT, 2002

The borrower/ guarantors are hereby notified to pay the sum as mentioned in the demand notice along with upto date interest and ancillary expenses before 15 days from the date of this notice, failing which the property will be auctioned/ sold and balance dues, if any, will be recovered with interest and cost.

Date: 18/09/2023 Place: Gujarat Signed by Authorized Officer, Home First Finance Company India Limited

દેશમાં ટેકનોલોજી અને ટેલિકોમ્યુનિકેશન કંપનીઓ માટે ભાગીદારી એક નવો માર્ગ

સ્પેક્ટ્રમ અને સેટેલાઈટ ટેકનોલોજી ઉપભોક્તા સામનો ધરાવતી એલિક્ટ્રોનિક્સમાં વધુને વધુ ઉપયોગ શોધી રહી છે, જેમ કે સેટેલાઈટ કોમ્યુનિકેશન (સેટેકોમ) અને ઈન્ટરનેટ કનેક્શન વિના સીધા મોબાઈલ અને ટીવીનું પ્રસારણ થાય છે. હ્યુજીસ કોમ્યુનિકેશન્સ ઈન્ડિયાના પ્રમુખ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે ઉત્તર યથાની તેમની પ્રથમ મીડિયા ઈન્ટરવ્યુમાં શિવાજી ચેટર્જીએ જતીન ચોવરને આવી તકનીકોના ઉપયોગ વિશે વધુ કરે છે, જેના દ્વારા માહિતી સંચાર તકનીક (આઈસીટી) જગ્યામાં વિવિધ કંપનીઓ વિકાસ કરી શકે છે.

આવવા માટે કેટલો સમય લેશે ? જવાબ : એપલ અને સેમસંગ જેવા સ્માર્ટફોન ઉત્પાદકો પહેલાથી જ તેમને સામેલ કરવાનું શરૂ કરી રહ્યાં છે. હું માનું છું કે, વોઈસ કનેક્ટિવિટી માટે તેને રથી ૩ વર્ષ લાગશે અને યોગ્ય વ્યાપક બેન્ડવિડેથ માટે વ્યાપારી ધોરણે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં લગભગ ૪થી ૫ વર્ષ લાગશે. તે એક મુશ્કેલીભર્યું સેવા હશે અને તેના રિયાલ અને વપરાશના આધારે ટેલિકોમ કંપનીઓની યોજનાઓ સાથે જોડી શકાય છે.

ટેકનોલોજી લાવવા માટે કામ કરી રહી છે. પ્રશ્ન : હ્યુજીસની વૈશ્વિક આવકમાં ભારતીય વ્યવસાયનો ફાળો કેટલો છે ? તમારો લક્ષ્યાંક શું છે ? જવાબ : અમારી પાસે ભારત ૧૭૫ એન્ટરપ્રાઇસિસ ગ્રાહકો છે અને ૧,૬૦,૦૦૦ જેટલી સાઈટ પણ છે. વૈશ્વિક સ્તરે હ્યુજીસની કુલ આવક બે બિલિયન ડોલર છે જેમાંથી ભારતનો ફાળો ૬૫ બિલિયન ડોલર જેટલો છે. અમે વૈશ્વિક વ્યવસાયમાં લગભગ ૩ ટકા ઈ.એ. અમે આગામી વર્ષોમાં આવક બમણી કરવા માગીએ છીએ.

ટેલિકોમ કંપનીઓ દ્વારા પ્રદાન કરવામાં આવેલ સોફ્ટવેર - વ્યાખ્યાયિત મલ્ટીપ્રોટોકોલ લેબલ સ્વિચિંગ નેટવર્કની તુલનામાં વધુ શક્તિઓ આવવાથી અને એન્ટરપ્રાઇસિસને સંચાલિત સેવાઓ અને ઉપગ્રહો દ્વારા વ્યાપક ક્ષેત્ર નેટવર્ક કનેક્ટિવિટી માટે વ્યવસાયો વચ્ચે વધતી જતી ટ્રેક્શન જેવી અમારી ઓફર, હ્યુજીસ ઈન્ડિયાની કામગીરીને પણ મદદ કરશે.

પ્રશ્ન : ટેલિકોમ કંપનીઓ ડાયરેક્ટ-ટુ-મોબાઈલ ટેકનોલોજીનો વિરોધ કરી રહી છે. શું તમને લાગે છે કે તે તમને અસર કરશે ? જવાબ : ટેલકો માટે તેને રાજ્ય ધકેલવાને બદલે સહયોગ કરવા માટે તે એક અદભૂત ટેકનોલોજી છે. આજે મુદ્દો એ છે કે જ્યારે તમે એવા ક્ષેત્ર પર જાઓ છો જે બહારના વિસ્તારમાં હોય ત્યારે તમારી પાસે સેલ કવરેજ નથી. ત્યાં તમે ડાયરેક્ટ-ટુ-ડિવાઈસનો ઉપયોગ કરશો.

પ્રશ્ન : ડાયરેક્ટ-ટુ-ડિવાઈસ ટેકનોલોજીમાં આજે ઈન્વેસ્ટ, થુરાયા જેવા સેટેલાઈટ ફોન છે, પરંતુ આ ફોન મોટા છે, તેઓ ભ્રમણક્રમમાં ઊંચા ઉપગ્રહો સાથે જોડાય છે. અને તેના કારણે તેઓ માલિકીના વાતાવરણમાં કામ કરે છે. જ્યારે અમારા સ્માર્ટફોન સેટેલાઈટ પર પણ કામ કરી શકે છે. ડાયરેક્ટ-ટુ-ડિવાઈસ માટે મોટી ડ્રાઈવ શું હશે. તે સૌથી મોટી પ્રથમ વસ્તુ છે. બીજું જો લીઓની પ્રમાણીઓ તેને ટેકો આપવાનું શરૂ કરે. તો ઉપગ્રહો ભ્રમણક્રમમાં ૩૬,૦૦૦ કિલોમીટર હોવાને બદલે લગભગ ૧,૦૦૦ કિલોમીટર સુધી આવી જાય છે. બીજી સમસ્યા એ છે કે ફોન પરની ડિટુએમ ટેકનોલોજી ઘરની અંદર કામ કરી શકતી નથી. ડિઝાઈન દ્વારા સામાન્ય સેલ્યુલર વપરાશની તુલનામાં ઉપયોગના કેસ મર્યાદિત છે. અમારી પેરેન્ટ કંપની ઈકોસ્ટાર આવી

પ્રશ્ન : તમને લાગે છે કે, ડાયરેક્ટ-ટુ-મોબાઈલ ટેકનોલોજી ભારતીય બજારમાં કંપની ઈકોસ્ટાર આવી

TPCODL
TP CENTRAL ODISHA DISTRIBUTION LIMITED
(A Joint Venture of Tata Power and Government of Odisha)
Power House Square, Unit - 8, Bhubaneswar - 751012

NOTICE

(Inviting attention of all vendors to submit pending bills for supply of goods & services pertaining to CESU for the period prior to 01.06.2020)

In line with vesting /other relevant orders, the Hon'ble Odisha Electricity Regulatory Commission (OERC) has directed to submit the pending bills / claims for the supply of goods and/or services pertaining to pre-vesting period i.e. prior to 01.06.2020 by 30.09.2023 in case of erstwhile CESU (now TPCOD).

Therefore, in compliance to the direction of Hon'ble OERC, notice is hereby given to vendors to submit the pending claims / bills with relevant supporting documents not later than 30.09.2023, at respective division office.

-SD- TP Central Odisha Distribution Limited

શરણમ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ
સીઆઈએન : L45201GJ19992PLC093662
રજીસ્ટર્ડ ઓફિસ : ૩૦૩, અર્ધ અરાઈઝ, વાય.એમ.સી.એ. કલબ પાસે, એસ.જી.સી.ડી, મહરવા, વેનલપુર, અમદાવાદ-૩૮૦૦૧૫. ફોન : ૦૭૯-૨૬૦૦૬૬૬.
ઈમેલ : sharanaminfra@project@gmail.com
વેબસાઈટ : www.sharanaminfra.co.in

કંપનીની ૩૧મી વાર્ષિક જનરલ મીટીંગ, બુક કલોઝર અને ઇ-વોટીંગની નોટીસ

આથી નોટીસ આપવામાં આવે છે કે :

૧. એગ્રુમેન્ટની નોટીસમાં નિર્ધારિત મુજબના સામાન્ય અને વિશેષ વ્યવસાયના વ્યવહારો કરવા માટે કંપનીના સભ્યોની ૩૧મી વાર્ષિક જનરલ મીટીંગ (એગ્રુમેન્ટ) વીડિયો કોન્ફરન્સિંગ (વીડી) અને ડુઅલ ટ્રાન્સ મધ્યમો (એગ્રુમેન્ટ) મારફતે યોજાશે, ૩૦મી સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ બપોરે ૦૨.૦૦ કલાકે યોજાવામાં આવશે. ૨.૧૨મી મે, ૨૦૨૦ ની તારીખની આગલી પહિલમુજબ, બીજા વખતોની સાથે ૩૧મી એગ્રુમેન્ટ માટે વાર્ષિક રિપોર્ટની નોટીસ નક્કર મોકલવાની આવશ્યકતા નથી. તેથી ૩૧મી સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ મુજબના સભ્યો યેનાના ઈમેલ અથવા ઈ-વોટીંગ/ડિજિટાઇઝેશન માટે નોંધાયેલા છે તેમને વાર્ષિક રિપોર્ટ માત્ર ઇલેક્ટ્રોનિક મોડ મારફતે મોકલવામાં આવી શકે છે. સભ્યો યેનાના ઈમેલ અથવા ઈ-વોટીંગ/ડિજિટાઇઝેશન માટે નોંધાયેલા છે તેમને વાર્ષિક રિપોર્ટ માત્ર ઇલેક્ટ્રોનિક મોડ મારફતે મોકલવામાં આવી શકે છે. સભ્યો યેનાના ઈમેલ અથવા ઈ-વોટીંગ/ડિજિટાઇઝેશન માટે નોંધાયેલા છે તેમને વાર્ષિક રિપોર્ટ માત્ર ઇલેક્ટ્રોનિક મોડ મારફતે મોકલવામાં આવી શકે છે.

૩. ૩૧મી એગ્રુમેન્ટની નોટીસ અને નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટેનો વાર્ષિક રિપોર્ટ કંપનીની વેબસાઈટ એટલે કે www.sharanaminfra.co.in, સેડસ એક્સચેન્જ પર એટલે કે બીએસઈ ટિમિટેડની વેબસાઈટ www.bseindia.com માટે પણ ઉપલબ્ધ કરવામાં આવશે.

૪. આથી વધુમાં નોટીસ આપવામાં આવે છે કે તેની હેઠળ બનાવેલા નિયમો સહિત કંપનીના એક્ટ, ૨૦૧૩ નો કલમ ૧૯ ના અનુક્રમમાં અને તેની (એલએસડીઆર) રેગ્યુલેશન, ૨૦૧૫ ના રેગ્યુલેશન ૨૨ મુજબ, ૩૧મી એગ્રુમેન્ટના હેતુને સમજાવવા માટે કંપનીની વેબસાઈટ પર ડુઅલ ટ્રાન્સ મધ્યમો, ૨૩મી સપ્ટેમ્બર, ૨૦૨૩ થી જાનવાર, ૩૦મી સપ્ટેમ્બર, ૨૦૨૩ (બંને દિવસો સહિત) બંધ રહેશે.

૫. સુધારેલ મુજબના કંપનીના (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) નિયમો, ૨૦૧૪ ના નિયમ ૨૦ સાથે વંચતી કંપનીના એક્ટ, ૨૦૧૩ ની કલમ ૧૯૮ અને તેની (રિસ્ટ્રીંગ ઓફિસર અન્ડ ડિરેક્ટોરિસ ટિક્સાવેન્ચર) રેગ્યુલેશન, ૨૦૧૫ નો કલમ ૪૪ મુજબ, કંપની નોટીસમાં નિર્ધારિત મુજબના તમામ ડસ્કવે ઇપર સભ્યોને એગ્રુમેન્ટના સ્થળ સહિત અન્ય કસ્ટોમર ઇલેક્ટ્રોનિક્સ (સિમેટ ઇ-વોટીંગ) તેમના નોટીસમાં આપવાની સુવિધા પૂરી પાડીને સંતુષ્ટ છે. યેના માટે કંપનીએ ઇ-વોટીંગ એન્ડ ટેલરે નોનલ સિક્યોરિટી ડિજિટાઇઝેશન (સિક્યોરિટી સેવાઓ લીધી છે. તમામ સભ્યોને પણ કરવામાં આવે છે કે :

એ. એગ્રુમેન્ટની નોટીસમાં નિર્ધારિત મુજબના સામાન્ય અને વિશેષ વ્યવસાયના વ્યવહારો ઇલેક્ટ્રોનિક મધ્યમો દ્વારા ઇ-વોટીંગ માટે કરવાના રહેશે.

બી. રિપોર્ટ ઇ-વોટીંગ ૨૩મી સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ સાંજે ૦૮.૦૦ કલાકે શરૂ થશે અને ૨૩મી સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ સાંજે ૦૪.૦૦ કલાકે સમાપ્ત થશે.

સી. ઇલેક્ટ્રોનિક મધ્યમો દ્વારા અથવા એગ્રુમેન્ટ માટે માત્ર આપવાની યોગ્યતા નિર્ધારિત કરવા માટેની કટ-ઓફ તારીખ જાનવાર, ૨૩મી સપ્ટેમ્બર, ૨૦૨૩ છે.

ડી. કોર્પોરાટ વ્યક્તિને સંબંધિત એગ્રુમેન્ટની નોટીસની રજાની પછી કંપનીના સેલો સંપાદિત કરી હોય અને કંપનીના સભ્ય બનાવેલ હોય અને કટ-ઓફ તારીખ એટલે કે જાનવાર, ૨૩મી સપ્ટેમ્બર, ૨૦૨૩ મુજબ કંપનીના સેલો ઘસવાવા હોય, તેને evoting@nsdl.co.in માટે વિનંતી મોકલવા દ્વારા લોગીન આઈડી અને પાસવર્ડ મેળવી શકે છે. જો કે તમે રિપોર્ટ ઇ-વોટીંગ માટે એગ્રુમેન્ટ સહિત સાથે આગામી નોંધાયેલા લેટ તો પછી તેમને તમારે માત્ર આપવા માટે હાલના યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી શકો છો.

ઇ. સભ્યો નોંધ લે છે કે (એ) એનએસડીએલ દ્વારા કલિંક તારીખ અને સમય પછી રિપોર્ટ ઇ-વોટીંગ મોડ્યુલ અસમ કરવામાં આવશે અને સભ્ય દ્વારા ડસ્કવે ઇપર અથવા માત્ર આઈડી અથવા પાસવર્ડ, સભ્યને તેને પાસવર્ડ બદલવાની મંજૂરી આપવામાં આવશે નહીં, (બી) ઇ-વોટીંગ સુવિધા એગ્રુમેન્ટ પછી એવા સભ્યો માટે ઉપલબ્ધ રહેશે જેમણે તેમને એગ્રુમેન્ટમાં ઉમેરવા સહિત રહી શકે પરંતુ કંપની માત્ર આપવા હકદાર રહેશે નહીં અને (સી) વ્યક્તિ યેનાનું નામ કટ-ઓફ તારીખ મુજબ સભ્યોના રજીસ્ટર અથવા ડિજિટાઇઝેશન દ્વારા જાનવારેલા લાભાર્થી માલિકીના રજીસ્ટરમાં નોંધાયેલ હશે માત્ર તેઓ જ રિપોર્ટ ઇ-વોટીંગની સુવિધા તેમજ જનરલ મીટીંગમાં મતદાન કરવા માટે હકદાર રહેશે.

૬. કંપનીએ રિપોર્ટ ઇ-વોટીંગ પ્રક્રિયાની નિમણૂક અને પારદર્શક ગ્રહણ કરી છે. ગૌરવ બાબાથી સેડસ એક્સચેન્જ સુધી રજીસ્ટર તરીકે નિમણૂક કરી છે.

૭. રિપોર્ટ ઇ-વોટીંગને સંબંધિત કોર્પોરાટ પુસ્તક અથવા કસ્ટોમર કંપનીના કંપની સેક્રેટરીને sharanaminfra@project@gmail.com ઈમેલ પાસે સંબંધિત કરી શકાશે અથવા કોર્પોરાટ વધારાના સ્પર્ધક સાથે તમે www.evoting.nsdl.com ના સહાયક ટેકનિકીય ઉપલબ્ધ સભ્યો માટે ફિન્ટેચની આસક્ત કનેક્શન (એક્સક્લુઝ) અને સભ્યો માટે રિપોર્ટ ઇ-વોટીંગ યુઝર મેનેજમેન્ટનો સંદર્ભ લઈ શકો છો અથવા ટેલ ફ્રી નં. ૧૮૦૦-૨૨૨-૮૮૦ ઉપર ઈમેલ કરી શકો છો.

શરણમ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ, માટે સહી/-
રિજીસ્ટ્રાર અધિકારીના હસ્તાક્ષર
તારીખ : ૧૮/૦૯/૨૦૨૩
સ્થળ : અમદાવાદ

યુનિયન બેંક ઓફ ઇન્ડિયા Union Bank of India
પહેલો માળ, રંગોલી કોમ્પ્લેક્સ, વી.એસ. હોસ્પિટલ સામે, એલિસબ્રીજ, અમદાવાદ-૩૮૦૦૦૬

સ્ટ્રેક્સ એસેટ મેનેજમેન્ટ શાખા
પહેલો માળ, રંગોલી કોમ્પ્લેક્સ, વી.એસ. હોસ્પિટલ સામે, એલિસબ્રીજ, અમદાવાદ-૩૮૦૦૦૬

ઈ-હરાજુ વેચાણ નોટિસ (સિક્યોરીટી ઈન્ટરેસ્ટ (એનફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ના નિયમ ૮(૬) અને ૯(૧))

આથી, તમે નીચેના નામનાઓએ **યુનિયન બેંક ઓફ ઇન્ડિયા** પાસેથી ક્રેડિટ સુવિધાઓ મેળવી હતી, અને બેંકને અહીં નીચે દર્શાવેલી બાકી રકમ વતી આગળનું વ્યાજ, પડતરો અને ચાર્જિસની ચુકવણી કરવામાં કસુરવાર થયા છો. તેથી, **યુનિયન બેંક ઓફ ઇન્ડિયા**એ સિક્યોરીટી ઈન્ટરેસ્ટ એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઈન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨ ના પરની કલમ ૧૩ હેઠળ પ્રાપ્ત સત્તાની રૂએ અહીં નીચે વિગતવાર દર્શાવેલી મિલકત અહીં નીચે વિગતવાર જણાવેલ વેબસાઈટ/પોર્ટલ મારફતે ઇ-હરાજુ કરીને બહેર હરાજુ દ્વારા વેચવાનો નિર્ણય કર્યો છે :

દેવાદારો / જામીનદારો / ગીરવેદારોનું નામ	કલમ ૧૩(૨) હેઠળ મંગણા નોટીસની તારીખ	કલમ ૧૩(૨) હેઠળ કબજા નોટીસની તારીખ	મંગણા નોટીસમાં દર્શાવેલ રકમ	અધિકૃત અધિકારી
(૧) મે. એનરારસ પ્રોજેક્ટ પ્રા. લિ. (દેવાદાર), ૩૫/બી, ચિનાર વડુ સોસાયટી, ગેટ વે હોટલ પાસે, અકોટા રોડ, વડોદરા-૩૮૦૦૦૫. ખાતે પણ: ૩૦૨, સિદ્ધિ સિદ્ધિ એવાળા, સુભાનપુરા, વડોદરા-૩૮૦૦૦૭. (૨) શ્રી નિમિત્ત રસિકલાલ સંગાણી (સહ-દેવાદાર અને ડાયરેક્ટર), સી-૩૦૨, ક્લિપ્પિંગ, વેદાંત ડુપ્લેક્સની સામે, ઘાઈટ ડે સ્કુલ પાસે, વાસણા રોડ, વડોદરા-૩૮૦૦૧૫. (૩) શ્રી કલ્પેશ મનસુખભાઈ જેઠાણી (સહ-દેવાદાર અને ડાયરેક્ટર), ૪૬, પુરપોતમ નગર, ૮, પૃથ્વી એપાર્ટમેન્ટ, બીપીસી રોડ, અકોટા, વડોદરા-૩૮૦૦૨૦. (૪) શ્રી રાહુલ મનસુખભાઈ જેઠાણી (સહ-દેવાદાર અને ડાયરેક્ટર), ૪૬, પુરપોતમ નગર, ૮, પૃથ્વી એપાર્ટમેન્ટ, બીપીસી રોડ, અકોટા, વડોદરા-૩૮૦૦૨૦. (૫) શ્રી જનક ગીરીભાઈ માલવી (સહ-દેવાદાર અને ડાયરેક્ટર), ડી-૬૦૨, સિલ્વરનેસ્ટ, વાસણા ભાયલી રોડ, વાસણા, વડોદરા-૩૮૦૦૧૫. (૬) શ્રી ભાવેશ કુમાર કુરુજીભાઈ નાકરાણી (સહ-દેવાદાર), ૩૦૫, રણછોડજી પાર્ક સોસાયટી, શિશુવિહાર સ્કુલ પાસે, કતારામણ, સુરત-૩૮૫૦૦૪. (૭) શ્રીમતી રાધિકા નિમિત્ત સંગાણી (જામીનદાર), સી-૩૦૨, ક્લિપ્પિંગ, વેદાંત ડુપ્લેક્સની સામે, ઘાઈટ ડે સ્કુલ પાસે, વાસણા રોડ, વડોદરા-૩૮૦૦૧૫. (૮) શ્રીમતી મિનાક્ષીબેન ઉર્ફે મીનાબેન આર. સંગાણી (જામીનદાર), બી-૧૩, જયુનાનગર સોસાયટી, ઘોડદોડ રોડ, સુરત-૩૮૫૦૦૧.	૨૪.૦૭.૨૦૧૯	૨૮.૧૧.૨૦૧૯	₹. ૨૪,૦૬,૨૦૧૯	શ્રી અમીત કુમાર સિંઘા, એગ્રુમેન્ટ

ક્રમ નં.	મિલકતોનું વર્ણન અને માલિકનું નામ	કબજાનો પ્રકાર	રીઝર્વ કિંમત	ઈએમડી રકમ
1	શ્રી નિમિત્ત રસિકલાલ સંગાણીના નામે આર.એસ.નં. ૧૧/૧ અને ૧૧/૨. આજવા રોડ, વડોદરા ખાતે ૬૦ ડેકમાં (૧૦૭૮.૮૮ ચો.ફીટ ગિલ્ટ અપ એરિયાના) ફ્લેટ નં. એ-૧૧૦૧.	સાંકેતિક	₹. ૨૨,૨૩,૦૦૦	૨,૨૨,૩૦૦
2	શ્રી નિમિત્ત રસિકલાલ સંગાણીના નામે આર.એસ.નં. ૧૧/૧ અને ૧૧/૨. આજવા રોડ, વડોદરા ખાતે ૬૦ ડેકમાં (૧૦૭૮.૮૮ ચો.ફીટ ગિલ્ટ અપ એરિયાના) ફ્લેટ નં. એ-૧૧૦૨.	સાંકેતિક	₹. ૨૨,૨૩,૦૦૦	૨,૨૨,૩૦૦
3	શ્રી નિમિત્ત રસિકલાલ સંગાણીના નામે આર.એસ.નં. ૧૧/૧ અને ૧૧/૨. આજવા રોડ, વડોદરા ખાતે ૬૦ ડેકમાં (૧૦૭૮.૮૮ ચો.ફીટ ગિલ્ટ અપ એરિયાના) ફ્લેટ નં. એ-૧૨૦૨.	સાંકેતિક	₹. ૨૨,૨૩,૦૦૦	૨,૨૨,૩૦૦
4	શ્રી નિમિત્ત રસિકલાલ સંગાણીના નામે આર.એસ.નં. ૧૧/૧ અને ૧૧/૨. આજવા રોડ, વડોદરા ખાતે ૬૦ ડેકમાં (૧૦૭૮.૮૮ ચો.ફીટ ગિલ્ટ અપ એરિયાના) ફ્લેટ નં. એ-૧૨૦૩.	સાંકેતિક	₹. ૨૨,૨૩,૦૦૦	૨,૨૨,૩૦૦
5	શ્રી નિમિત્ત રસિકલાલ સંગાણીના નામે આર.એસ.નં. ૧૧/૧ અને ૧૧/૨. આજવા રોડ, વડોદરા ખાતે ૬૦ ડેકમાં (૧૦૭૮.૮૮ ચો.ફીટ ગિલ્ટ અપ એરિયાના) ફ્લેટ નં. એ-૧૨૦૪.	સાંકેતિક	₹. ૨૨,૨૩,૦૦૦	૨,૨૨,૩૦૦
6	શ્રી નિમિત્ત રસિકલાલ સંગાણીના નામે આર.એસ.નં. ૧૧/૧ અને ૧૧/૨. આજવા રોડ, વડોદરા ખાતે ૬૦ ડેકમાં (૧૦૭૮.૮૮ ચો.ફીટ ગિલ્ટ અપ એરિયાના) ફ્લેટ નં. બી-૧૦૪.	સાંકેતિક	₹. ૧૫,૨૨,૦૦૦	૧,૫૨,૨૦૦
7	શ્રી નિમિત્ત રસિકલાલ સંગાણીના નામે આર.એસ.નં. ૧૧/૧ અને ૧૧/૨. આજવા રોડ, વડોદરા ખાતે ૬૦ ડેકમાં (૧૦૭૮.૮૮ ચો.ફીટ ગિલ્ટ અપ એરિયાના) ફ્લેટ નં. બી-૧૦૪.	સાંકેતિક	₹. ૧૫,૨૨,૦૦૦	૧,૫૨,૨૦૦
8	શ્રી નિમિત્ત રસિકલાલ સંગાણીના નામે આર.એસ.નં. ૧૧/૧ અને ૧૧/૨. આજવા રોડ, વડોદરા ખાતે ૬૦ ડેકમાં (૧૦૭૮.૮૮ ચો.ફીટ ગિલ્ટ અપ એરિયાના) ફ્લેટ નં. બી-૧૦૩.	સાંકેતિક	₹. ૧૫,૨૨,૦૦૦	૧,૫૨,૨૦૦
9	શ્રી નિમિત્ત રસિકલાલ સંગાણીના નામે આર.એસ.નં. ૧૧/૧ અને ૧૧/૨. આજવા રોડ, વડોદરા ખાતે ૬૦ ડેકમાં (૧૦૭૮.૮૮ ચો.ફીટ ગિલ્ટ અપ એરિયાના) ફ્લેટ નં. બી-૧૦૪.	સાંકેતિક	₹. ૧૫,૨૨,૦૦૦	૧,૫૨,૨૦૦
10	શ્રી નિમિત્ત રસિકલાલ સંગાણીના નામે આર.એસ.નં. ૧૧/૧ અને ૧૧/૨. આજવા રોડ, વડોદરા ખાતે ૬૦ ડેકમાં (૧૦૭૮.૮૮ ચો.ફીટ ગિલ્ટ અપ એરિયાના) ફ્લેટ નં. બી-૨૦૩.	સાંકેતિક	₹. ૧૫,૨૨,૦૦૦	૧,૫૨,૨૦૦
11	શ્રી નિમિત્ત રસિકલાલ સંગાણીના નામે આર.એસ.નં. ૧૧/૧ અને ૧૧/૨. આજવા રોડ, વડોદરા ખાતે ૬૦ ડેકમાં (૧૦૭૮.૮૮ ચો.ફીટ ગિલ્ટ અપ એરિયાના) ફ્લેટ નં. બી-૨૦૪.	સાંકેતિક	₹. ૧૫,૨૨,૦૦૦	૧,૫૨,૨૦૦
12	શ્રી નિમિત્ત રસિકલાલ સંગાણીના નામે આર.એસ.નં. ૧૧/૧ અને ૧૧/૨. આજવા રોડ, વડોદરા ખાતે ૬૦ ડેકમાં (૧૦૭૮.૮૮ ચો.ફીટ ગિલ્ટ અપ એરિયાના) ફ્લેટ નં. બી-૨૦૩.	સાંકેતિક	₹. ૧૫,૨૨,૦૦૦	૧,૫૨,૨૦૦
13	શ્રી નિમિત્ત રસિકલાલ સંગાણીના નામે આર.એસ.નં. ૧૧/૧ અને ૧૧/૨. આજવા રોડ, વડોદરા ખાતે ૬૦ ડેકમાં (૧૦૭૮.૮૮ ચો.ફીટ ગિલ્ટ અપ એરિયાના) ફ્લેટ નં. બી-૨૦૪.	સાંકેતિક	₹. ૧૫,૨૨,૦૦૦	૧,૫૨,૨૦૦
14	શ્રી નિમિત્ત રસિકલાલ સંગાણીના નામે આર.એસ.નં. ૧૧/૧ અને ૧૧/૨. આજવા રોડ, વડોદરા ખાતે ૬૦ ડેકમાં (૧૦૭૮.૮૮ ચો.ફીટ ગિલ્ટ અપ એરિયાના) ફ્લેટ નં. બી-૨૦૪.	સાંકેતિક	₹. ૧૫,૨૨,૦૦૦	૧,૫૨,૨૦૦
15	શ્રી નિમિત્ત રસિકલાલ સંગાણીના નામે આર.એસ.નં. ૧૧/૧ અને ૧૧/૨. આજવા રોડ, વડોદરા ખાતે ૬૦ ડેકમાં (૧૦૭૮.૮૮ ચો.ફીટ ગિલ્ટ અપ એરિયાના) ફ્લેટ નં. બી-૨૦૧.	સાંકેતિક	₹. ૧૫,૨૨,૦૦૦	૧,૫૨,૨૦૦
16	શ્રી નિમિત્ત રસિકલાલ સંગાણીના નામે આર.એસ.નં. ૧૧/૧ અને ૧૧/૨. આજવા રોડ, વડોદરા ખાતે ૬૦ ડેકમાં (૧૦૭૮.૮૮ ચો.ફીટ ગિલ્ટ અપ એરિયાના) ફ્લેટ નં. બી-૨૦૦૨.	સાંકેતિક	₹. ૧૫,૨૨,૦૦૦	૧,૫૨,૨૦૦
17	શ્રી રાહુલ મનસુખભાઈ જેઠાણીના નામે આર.એસ.નં. ૧૧/૧ અને ૧૧/૨. આજવા રોડ, વડોદરા ખાતે ૬૦ ડેકમાં (૮૫૦.૮૦ ચો.ફીટ ગિલ્ટ અપ એરિયાના) ફ્લેટ નં. સી-૧૦૦૨.	સાંકેતિક	₹. ૧૭,૫૧,૦૦૦	૧,૭૫,૧૦૦
18	શ્રી રાહુલ મનસુખભાઈ જેઠાણીના નામે આર.એસ.નં. ૧૧/૧ અને ૧૧/૨. આજવા રોડ, વડોદરા ખાતે ૬૦ ડેકમાં (૮૫૦.૮૦ ચો.ફીટ ગિલ્ટ અપ એરિયાના) ફ્લેટ નં. સી-૧૦૦૩.	સાંકેતિક	₹. ૧૭,૫૧,૦૦૦	૧,૭૫,૧૦૦
19	શ્રી રાહુલ મનસુખભાઈ જેઠાણીના નામે આર.એસ.નં. ૧૧/૧ અને ૧૧/૨. આજવા રોડ, વડોદરા ખાતે ૬૦ ડેકમાં (૮૫૦.૮૦ ચો.ફીટ ગિલ્ટ અપ એરિયાના) ફ્લેટ નં. સી-૧૦૩.	સાંકેતિક	₹. ૧૭,૫૧,૦૦૦	૧,૭૫,૧૦૦
20	શ્રી રાહુલ મનસુખભાઈ જેઠાણીના નામે આર.એસ.નં. ૧૧/૧ અને ૧૧/૨. આજવા રોડ, વડોદરા ખાતે ૬૦ ડેકમાં (૮૫૦.૮૦ ચો.ફીટ ગિલ્ટ અપ એરિયાના) ફ્લેટ નં. સી-૧૦૩.	સાંકેતિક	₹. ૧૭,૫૧,૦૦૦	૧,૭૫,૧૦૦
21	શ્રી રાહુલ મનસુખભાઈ જેઠાણીના નામે આર.એસ.નં. ૧૧/૧ અને ૧૧/૨. આજવા રોડ, વડોદરા ખાતે ૬૦ ડેકમાં (૮૫૦.૮૦ ચો.ફીટ ગિલ્ટ અપ એરિયાના) ફ્લેટ નં. સી-૧૦૩.	સાંકેતિક	₹. ૧૭,૫૧,૦૦૦	૧,૭૫,૧૦૦
22	શ્રી રાહુલ મનસુખભાઈ જેઠાણીના નામે આર.એસ.નં. ૧૧/૧ અને ૧૧/૨. આજવા રોડ, વડોદરા ખાતે ૬૦ ડેકમાં (૮૫૦.			